

VOL. No. 02 ISSUE No. 12 DECEMBER 2016 PRICE 30/-

બાબકો અને નવયુવાનો માટે

રબીઉસ્સાની, હિજરી સન ૧૪૩૮
ડીસેમ્બર - ૨૦૧૬

અંક-૧૨



إمامنا محمد بن عبد الله

ઈમામ હસન અસ્કરી (અ.સ.) સામરા, ઈરાક

سلام عليكم بما صبرتم فنعم عقبى الدار



السلام على الشهداء القديسين
السلام على الجيوش الشاهديين
السلام على الدعوات السالوات

બઈસ્મેહી સુખ્હાનહૂ તઆલા

મારા પ્રિય બાળકો અને નવયુવાનો!

આપ સઘળા મિત્રોએ હાદીને સતત આગળ ધપાવવામાં સહાયતા કરી છે અને તેને આગળ વધાર્યો છે તે માટે અમો આપના અંતઃકરણપૂર્વક આભારી છીએ.

રબીઉસ્સાનીનો મહીનો આપણાં જીવનમાં એક મહત્વનો પુષ્પગુચ્છ લઈને આવ્યો છે. આમ તો સઘળા અઈમ્મએ માઅસૂમીન અ.સ.ની વિલાદત આપણાં માટે મહાન ખુશાલીનો પ્રસંગ હોય છે પરંતુ ઈમામ હસને અસ્કરી અ.સ.ની પુણ્યશાળી વિલાદત એ આપણાં જીવનમાં એક મહાન સોગાત છે કેમકે આ દિવસે આપણાં ઈમામ ઝમાના અજ.ની સેવામાં આપના મહાન પિતાની વિલાદતની મુબારકબાદી પાઠવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કરીએ છીએ.



આપની વિલાદત થકી ખુદાવન્દે આલમે આ જગતમાં ક્યામત પર્યંત ઈમામતની શુંખ્લાની અંતિમ કડીને લાવવાની વ્યવસ્થા કરી અને આપ અ.સ.ની વિલાદત જરૂરિયાતવાળાઓ માટે સંતોષ મેળવવાનું કારણ થઈ છે.

આમ તો દરેક ઈમામ પોતાના ચાહવાવાળાઓ માટે આરામ આશાએશ અને નેઅમતોનો સ્ત્રોત હોય છે. તેમ છતાંયે દરેક ઈમામ અ.સ. સાથે કોઈ ન કોઈ એક ખાસ બાબત સંકળાએલી છે અને તે રીતે ઈમામ હસને અસ્કરી અ.સ.ની હસ્તી એ હસ્તી છે કે જેમનાથી પરલોકની હાજતો (આખેરતની હાજતો) પૂર્ણ કરાવવાનું સંકળાએલ છે, એટલે કે આપ અ.સ. એવી અલ્લાહની નેઅમત છે કે જેમના થકી ખુદાના બંદાઓને પોતાની આખેરતની હાજતો પૂરી કરાવવાનું માધ્યમ પ્રાપ્ત થએલ છે અને તે એટલા માટે કે આપ અ.સ. જીવિત ઈમામ અ.સ.ના મહાન પિતા છે.

આપણે આ માસના પુણ્યપ્રભાવથી લાભાન્વિત થવાના પ્રયાસ કરવા જોઈએ અને આપ અ.સ.ની વિલાદતના દિવસે મહેફિલનું આયોજન કરવું જોઈએ કે જેથી કરીને આપણાં ઈમામે હાઝિર અજ.ની સેવામાં મુબારકબાદી પેશ કરી શકીએ.

વસ્સલામ



ઝેરે સર પર સ્ત્રી હઝરો હુજૂત

અરવાહોના ફિદાહ, અજજલલ્લાહો તઆલા ફરજહુશરીફ

મહુમ જનાબ મૌલાના આબીદ હુસૈન રીઝવી

સાહેબની યાદમાં

મુખ્ય તંત્રી :

સૈયદ મોહમ્મદ રેઝા રિઝવી ગરવી

કાર્યવાહક તંત્રી :

સૈયદ મોહમ્મદ અફ્ફર

સૈયદ આબીદ હુસૈન એ રિઝવી 7383560072

સહાયકો :

અહમદ રેઝા ગુરારહ

તાલીમ રેઝા અજમેરી

એહસાન અલી રિઝવી

અનુવાહક :

સૈયદ મોહમ્મદ ફાઝિલ બુખારી આઈ. એ. એસ (નિવૃત્ત)

શુષોભન :

Web Graphics મોહમ્મદ તાહીર

9898937633 E-mail: smtahir202@gmail.com

ટુરીંગ એજન્ટ :

સૈયદ મીસમ મેહદી રિઝવી 9510344219

“હાદી” માસિકના મેમ્બર બનવા માટે સંપર્ક કરો:

- અમદાવાદ:** (૧) શબ્બીર ભાઈ નુરાની, ફોન: ૯૩૭૬૧૬૮૩૦૬
 (૨) મૌલાના ઝફરુલ હસન, ફોન: ૯૩૨૭૫૩૬૬૩૮
 (૩) ઝકીર ભાઈ મોમીન, ફોન: ૯૩૨૭૦૪૧૩૧૪
- ભાવનગર:** મુસ્તાકભાઈ વિરાણી, ફોન: ૯૮૨૪૫૩૮૧૧૪
- મહુવા:** મહેદીરઝા એમ. બંભોરા, ફોન: ૯૮૨૪૩૨૭૨૨૭
- કાણોદર:** નૌશાદભાઈ, જાફરી ચેનલ, ફોન: ૯૮૯૮૭૭૩૬૧૧
- મેતા:** મોહસીનભાઈ કદાવાલ, ફોન: ૯૮૯૮૩૬૯૦૮૯
- ભરૂચ:** મુશ્તાકઅલી પાનવાલા, ફોન: ૯૮૨૪૨૪૩૦૫૧

- ઘોળકા:** કમરઅલી મોમીન
- અંબાર:** રફીકભાઈ ખોજા, ફોન: ૯૮૨૫૩૧૮૬૨૧
- રૂસ્તમપૂરા:** સૈયદ આશીક હુસૈન, ફોન: ૯૮૨૪૧૧૯૩૭૨
- રાજૂલા:** મૌલાના હસન મહેદી, ફોન: ૯૮૦૪૧૪૬૧૧૦
- સેલવાસા:** ગુલામ અબ્બાસભાઈ દેવજાણી, ફોન: ૯૮૨૫૯૯૯૯૭૮
- સિહોર:** હસનઅલી વજીરઅલી વસાયા, ફોન: ૯૮૭૯૯૬૯૯૬૯
- કચ્છ:** મુશ્તાક હુસૈન અબ્દુલ હુસૈન માસ્ટર, ફોન: ૯૮૨૪૨૧૬૪૭૦
- ડેડીયાપાસ:** રિઝવાન હુસૈન અમીરઅલી રાજાણી, ફોન: ૯૪૨૭૧૭૫૨૩૧

ખાસ નોંધ: સભ્ય તથા એજન્ટ મિત્રોને નમ્ર અરજ છે કે જેનું અગાઉનું લવાજમ બાકી છે તે અને નવા વર્ષનું લવાજમ મોકલી આપવા વિનંતી.

વિગતો માટે સંપર્ક :

(રહ.)

હૌઝએ ઈલમીયહ ઈમામ ખુમૈની ગોલ્ડન પાર્ક, વટ્યા, અમદાવાદ, ગુજરાત, ભારત

E-mail: hadimasik@yahoo.com Website: www.hadikids.org

PHONE NO: 079-25892786, 94266 78614, 70969 21472, 97247 37865

વાર્ષિક લવાજમ: રૂપિયા ૩૦૦/-

અહલેબૈત અ.સ.નો

પોતાના મિત્રો સાથેનો પ્રેમ

આપણે પોતાના હૃદયમાં અહલેબૈત અ.સ. પ્રત્યે પ્રેમભાવ ધરાવીએ છીએ. આ પ્રેમભાવ આ મહાન આત્માઓના હૃદયમાં પણ હોય છે કેમકે જે લોકો ખાનદાને નબુવ્વત અ.સ.ના ચાહકો છે તેઓ આ મહાન આદરણીય આત્માઓના પણ પ્રિય પાત્ર છે.

હબીશ-બિન-મોઅતમરે કહ્યું છે કે: “એક વખત હું અમીરુલ મોઅમેનીન હઝરત અલી અ.સ.ની સેવામાં હાજર થયો અને અરજ ગુજારી: “હે અમીરુલ મોઅમેનીન અ.સ.! આપના ઉપર સલામ હજો અને આપની ઉપર ખુદાની દયા-કૃપા હજો! આપની સવાર કેવી સ્થિતિમાં થઈ?”

આપ અ.સ.એ ફરમાવ્યું કે: “મે આખી રાત્રી મારા સાથે પ્રેમભાવ રાખનારાઓના પ્રેમમાં અને મારા શત્રુઓ સાથેની શત્રુતામાં વિતાવી.” (બિહારુલ અનવાર, ભાગ ૨૭, પાન નં ૫; મજાલિસે શૈખ મુફીદ, પાન નં ૧૮૭)

જ્યારે અહલેબૈત અ.સ.ના મનમાં કોઈ વ્યક્તિ માટે પ્રેમભાવ થઈ જાય છે ત્યારે તે વ્યક્તિ ખુદાનું પણ પ્રિય પાત્ર બની જાય છે અને તેના હૃદયમાં પણ ખુદાનો પ્રેમ પ્રજ્વલિત થઈ જાય છે અને જ્યારે ખુદા પ્રત્યેનો તેનો પ્રેમભાવ એટલો વધી જાય કે તેના મનમાં બીજા કોઈ માટે જગ્યા જ ન રહે તો ત્યારે તેના દિવ્ય ચક્ષુઓ ઉઘડી જાય છે અને તે વ્યક્તિ “અવલિયાએ ખુદા”ને ઓળખતો થઈ જાય છે.



મૌલાએ કાએનાત હઝરત અલી અ.સ.એ ફરમાવ્યું છે કે:

શબ્દે મેઅરાજમાં ખુદાએ પયગમ્બરે અકરમ સ.અ.વ. ને ફરમાવ્યું કે: જો કોઈ મારા માન પ્રસન્નતા ખાતર જ પોતાના સઘળા કાર્ય કરે તો હું તેનામાં ત્રણ ગુણો પેદા કરી દઉં છું:

૧. હું તેને (ખુદાનો) પાડ માનવાની પધ્ધતિ શીખવાડી દઉં છું કે જેથી તે અજ્ઞાનીઓની જેમ (મારો) પાડ ન માને.

૨. હું એને એવી મનની શુધ્ધતા આપું છું કે જેમાં કોઈ અશુધ્ધિ ન હોય.

૩. હું તેને મારો એવો પ્રેમ આપું છું કે તેના ઉપર અન્ય કોઈનો પ્રેમભાવ છવાઈ જઈ શકે નહીં.

આમ જે પણ મારી સાથે પ્રેમ કરશે હું પણ તેની સાથે પ્રેમ કરીશ અને તેને દિવ્યદ્રષ્ટિ આપીને મારા “જલાલ” (પ્રભુત્વ)ના દર્શન કરાવીશ અને મારી સૃષ્ટિના ગુણો તેનાથી ગુપ્ત નહીં રાખું. (ખિહારુલ અનવાર, ભાગ ૭૭, પાન નં ૨૮)

આ કારણે જ ખુદાના પ્રેમની નિશાનીઓ પૈકી એક એ છે કે વ્યક્તિ “અવલિયાએ ખુદા” અને તેની સૃષ્ટિનો જાણકાર થઈ જાય છે.



ઈમામતનું આચારમું પુષ્પ



✚ નામ અને વંશ: ✚

- પુણ્યશાળી નામ: હસન અ.સ.
- વિશેષણ (લક્ષણ): અસ્કરી અ.સ.
- વંશવાચક નામ (કુનીયત): અબૂ મુહમ્મદ અ.સ.
- પિતાનું પુણ્યશાળી નામ: અલી અ.સ.
- માતાનું પુણ્યશાળી નામ: હદીસ, સલીલ (કે જેઓ ઈબાદત, પવિત્રતા અને દાનવીરતામાં પોતાના સમકાલિનોમાં દ્રષ્ટાંતરૂપે હતાં.)
- પુણ્યશાળી જન્મની તારીખ: ૮ રબીઉલ્સાની હિ.સ. ૨૩૨
- પુણ્યશાળી જન્મ સ્થળ: મદીના મુનવ્વરા
- ઈમામતનો કાર્યકાળ: ૬ વરસ
- પુણ્યશાળી વય: ૨૮ વરસ
- શહાદતની તારીખ: ૮ રબીઉલ અવ્વલ હિ.સ. ૨૬૦
- શહાદતનું કારણ: મોઅતમદ અબ્બાસીએ આપને ઝેર આપીને શહીદ કરી દીધાં હતાં.
- આપનો અતિપવિત્ર રોઝો: ઈરાક (સામરા)
- અંગૂઠીના નંગનું નક્શા: “ઈબ્રાહીમ શહીદ”



✚ ✚ **ઈમામત:** ✚ ✚

આપણાં અગ્યારમાં ઈમામ અ.સ.એ પોતાના મહાન પિતાની શહાદત પછી ખુદાની આજ્ઞા અને પુરોગામી ઈમામ અ.સ.ની નિયુક્તિથી ઈમામતનું અતિમહાન પદ ગ્રહણ કર્યું અને આપ અ.સ.ને પોતાના છ વરસના ઈમામતના કાર્યકાળમાં તે વખતના ખલીફાઓના અત્યાચારો અને જુલ્મોને કારણે ખૂબ જ સાવચેતીપૂર્વક રહેવું પડ્યું હતું. તેથી આપ અન્ય લોકોને એટલે સુધી કે પોતાના શીઆઓને પણ પોતાની પાસે આવવાની પરવાનગી આપતાં નહોતાં. કેટલાંક એ ખાસ વ્યક્તિઓ કે જેમને આપ પોતાના અત્યંત અંગત માનતાં હતાં તે સિવાય કોઈ આપને મળી શકતું નહીં, આમ એક રીતે તો આપે નજરકેદમાં જ જીવન વિતાવ્યું હતું.

طَيِّبْنَ بَيْتَ الْعَمَلِ

આ બધાં નિયંત્રણો અને દબાણનું કારણ એ હતું કે તે યુગમાં શીઆઓની સંખ્યા અને શક્તિ-પ્રભાવ ખૂબ જ વધી ગયાં હતાં અને શીઆઓ “ઈમામત”માં શ્રદ્ધા રાખતાં હોવાથી અને શીઆઓના ઈમામો પણ જાણીતાં હતાં તેથી દરેક ખલીફા (સમ્રાટ) પોતાના યુગના ઈમામને વધુમાં વધુ નિયંત્રણો અને નજરબંદીમાં રાખતો હતો અને શક્ય તેટલાં પ્રયત્નો કરીને પોતાના ગુપ્ત પ્રપંચો રચીને અઈમ્મા અ.સ.ને ખત્મ કરી દેવાનો જ પ્રયાસ કરતો હતો. બીજું કારણ એ હતું કે ખલીફાને આ વાતની જાણકારી મળી ચૂકી હતી કે શીઆઓ અગ્યારમાં ઈમામ અ.સ.ના સુપુત્ર (ઈમામ મહદી અજ.)માં શ્રદ્ધા ધરાવે છે અને અગ્યારમાં ઈમામ અ.સ. અને પુરોગામી અઈમ્મા અ.સ.ની હદીસો પણ એ વાત જણાવતી હતી કે આ સુપુત્ર જ “ઈમામ મહદીયે મૌઊદ (અજ.)” હશે કે જેમના વિશે સતત હદીસોથી દરેકને જાણકારી આપવામાં આવી હતી અને (શીઆઓ) તેમને બારમાં અને અંતિમ ઈમામ અજ. માને છે. તેથી જ ખલીફાએ અગ્યારમાં ઈમામ અ.સ.ને અન્ય ઈમામોથી વધારે નિયંત્રણોમાં રાખ્યાં હતાં અને તે સમયનો ખલીફા પણ કૃતનિશ્ચયી હતો કે જેમ બને તેમ આ “શીઆ ઈમામ”ની વાર્તાનો જ અંત આણી દે અને આ બાબતનો અંત જ આવી જાય. તેથી અગ્યારમા ઈમામ અ.સ.ની બીમારીના સમાચાર ખલીફાને મળ્યાં કે તરત જ તેણે પોતાના વિશ્વાસુ પેઢોને આપ અ.સ.ની પાસે મોકલી દીધાં. પોતાની અત્યંત વિશ્વાસુ

یا ابا محمد یا حسن بن علی ایها الزکی العسکری یا بن رسول اللہ یا حجة اللہ علی خلقہ یا
 سیدنا و مولانا انا توجهنا و استشفعنا و توسلنا بک الی اللہ و قد مناک باین یدی حاجاتنا یا
 وحبیہا عند اللہ اشفع لنا عند اللہ

એવી કેટલીક વ્યક્તિઓ કે જેઓ કામી (ન્યાયધિશો) હતાં તેમને આપ અ.સ.ના ઘરે નિયુક્ત કરી દીધાં કે તેઓ ઘરની અંદરની અને બહારની પરિસ્થિતિની જાણકારી મેળવતા રહે. ઈમામ અ.સ.ની શહાદત પછી પણ આપના મુબારક ઘરની ઝડતી લેવામાં આવી અને દાયણો મારફતે આપની “કનીઝો” (દાસીઓ)ની તપાસ કરાવવામાં આવી હતી. ખલીફાના આ કાર્યકર્તાઓ બે વરસ સુધી આપના પુત્રને શોધતાં રહ્યાં અને છેવટે નિરાશ જ થવું પડ્યું. અગ્યારમાં ઈમામ અ.સ.ને આપના ઘરની અંદર જ સામર્શ શહેરમાં આપ અ.સ.ના પવિત્ર પિતાની પાસે જ દફન કરવામાં આવ્યાં હતાં.

આપણે એ જાણી લેવું જોઈએ કે અઈમ્મએ અહલેબૈત અ.સ.એ પોતાના જીવનમાં અસંખ્ય વિદ્વાનો, હદીસનું વર્ણન કરનારાઓ (મુહદ્દેસીન) અને ચિંતકોને વિદ્યા અને જ્ઞાનના આભુષણોથી શણગાર્યાં હતાં કે જેમની સંખ્યા સેંકડો નહીં પણ હજારો સુધી પહોંચે છે. પરંતુ સ્થાન સંકોચને કારણે અમે તેમના નામો, વિગતો અને તેમની કૃતિઓની યાદી અત્રે આપી શકીએ તેમ નથી. (ઈશાદિ મુફીદ, પાન નં ૩૧૫; દલાએલુલ ઈમામત, પાન નં ૨૨૩; ફુસુલુલ મોહિમ્મહ, પાન નં ૨૬૬-૨૭૧; મનાકિબે ઈબને શહેર આશોબ, ભાગ ૪, પાન નં ૪૨૧; ઉસૂલે કાફી, ભાગ ૧, પાન નં ૫૦૨)

કુરઆને મજુદમાં

અનેક વિદ્યાઓ અંગેના

ઉલ્લેખો

૬. કુરઆન અને પ્રાણીશાસ્ત્ર:

“વ-મા-મિન દાબ્બતિન ફિલ-અર્-વ-લા-તાએરિન ચતીરો બે-જિનાહયહે ઇલ્લા ઉમમુન અમ્સાલોકુમ.”

અર્થાત: “અને પૃથ્વી ઉપર ચાલનાર કોઈ પ્રાણી અથવા હવામાં ઉડનાર કોઈ પક્ષી એવા નથી કે જે તમારા (મનુષ્યો) જેવી જાતિ-સમૂહ ધરાવતાં ન હોય.” (સૂરએ અન્આમ, આયત ૩૮)

તત્વચિંતકોનું જગત પ્રાણીઓમાં સામુહિક ચેતનાને સ્વીકારતું હોય કે ન હોય - તે બુદ્ધિ અને સમજશક્તિને માત્ર મનુષ્ય સાથે સબંધિત માનતો હોય કે ન માનતો હોય પરંતુ કુરઆન સ્પષ્ટ શબ્દોમાં એ હકીકતની ઘોષણા કરે છે કે સામુહિક ચેતના માત્ર માનવજાતિ પૂરતી સિમિત નથી. પરંતુ આ સામુહિક ચેતના સમગ્ર પ્રાણી જગત અને પક્ષી જગતમાં પણ અસ્તિત્વ ધરાવે છે. બધાંની સામુહિક સમસ્યાઓ છે અને બધાંની એક સામુહિક કાર્ય પદ્ધતિ છે કે જેના વડે આ સામુહિક સમસ્યાઓ ઉકેલવામાં આવે છે.



આપ દરરોજ જુઓ છો કે શેરીમાં એક કુતરા ઉપર હુમલો કરવામાં આવે તો શેરીના તમામ કુતરા એકી સાથે જવાબ આપે છે. એક પ્રાણી મરી જાય તો તે જાતિના સઘળા પ્રાણીઓ શોકાતૂર થઈ જાય છે. એક ઘેટો આગળ ચાલે છે તો સઘળા ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે. એક કીડી કોઈ મીઠી વસ્તુ તરફ જાય છે તો કીડીઓની એક લાઈન લાગી જાય છે. એક પક્ષી પોતાના માળા તરફ ઉડવા લાગે છે તો સઘળા પક્ષીઓ તે દિશામાં જ ઉડવા લાગે છે. આવી તો ઘણી બાબતો આપણે રાત દિવસ જોતાં-અનુભવતાં હોઈએ છીએ.

કુરઆને મજુદમાં કીડીઓની સામુહિક પ્રતિકારશક્તિનું વર્ણન પણ છે. આ બાબત ઉપરથી માનવજાતિએ પણ બોધપાઠ લઈને સમાજની સામુહિક શક્તિઓ અને અરસપરસના સહકારના લાભોને અંદરોઅંદરના મતભેદોને કારણે નષ્ટ કરી નાંખવા જોઈએ નહીં અને પ્રાણીઓના જ રાત-દિવસના અનુભવોને લક્ષમાં લઈને સમાજને એકતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ બનાવવું જોઈએ.

૭. કુરઆન અને રસાયણશાસ્ત્ર:

“વ-ઈન્ના લક્કુમ ફિલ-અન્-આમે લ-ઈબરતન.”

અર્થાત: “અને નિઃસંશય તમારા માટે પ્રાણીઓમાં પણ બોધપાઠ મોજૂદ છે.” (સૂરએ નહલ, આયત ૬૬)

હરણની ડુટીમાં કસ્તૂરી, કીડાની લાળમાં રેશમ, મધમાખી પોતાના મોટે જુદા-જુદા ફળોના રસ ચૂસે તેમાંથી મધ બની જવું એ બધું એ દર્શાવે છે કે પ્રાણીઓમાં રસાયણશાસ્ત્રનું જ્ઞાન મનુષ્યો કરતાં વધારે છે અને આમાં માનવજાત માટે બોધપાઠ રહેલો છે!

અગવ્યવ્વા પ્રશ્નો

ઈમામ અલી અ.સ.ને કેટલાંક પ્રશ્નો પૂછવામાં
આવ્યાં હતાં:

- આકાશથી વધારે સખત શું છે?
- પૃથ્વીથી વધારે વિસ્તૃત શું છે?
- સમુદ્રથી વધારે નિઃસ્પૃહ કોણ છે?
- પત્થરથી વધારે કઠણ કોણ છે?
- સખ શિયાળાથી પણ વધારે ઠંડું કોણ છે?
- ઝેરથી વધારે કડવું શું છે?




ઈમામ અલી અ.સ.એ આ સઘળા પ્રશ્નોના જવાબ
આવી રીતે આપ્યાં:

- આકાશથી વધારે સખ્ત જેણે આપરાધ ન કર્યો હોય તેવા વ્યક્તિ ઉપર ખોટું આળ મુકવું તે છે.
- પૃથ્વીથી વધારે વિસ્તૃત-વિશાળ સત્યના માપ-દંડ (ધારાધોરણો-હક-સત્ય એટલે અલ્લાહ) છે.
- સમુદ્રથી વધારે નિઃસ્પૃહ સંતોષી મોમિન વ્યક્તિનું મન છે.
- પત્થરથી વધારે કઠણ મુનાફિક વ્યક્તિનું હૃદય હોય છે.
- અગ્નિથી વધારે ગરમ અને દઝાડનાર અત્યાચારી રાજા છે.
- સખ્ત શિયાળાથી વધારે ઠંડું કંજુસ પાસે યાચના કરવી તે છે.
- અને ઝેરથી વધારે કડવું ઘેર્ય રાખવું તે છે.

(કિતાબે નસાએહ, પાન નં ૨૭૧)





ખુદાની સાથે રહો અને રાજશાહી ભોગવો

કુરઆને મજુદ:-

કુરઆને મજુદમાં ખુદાવન્દે આલમે ઈશાદિ ફરમાવ્યું છે કે:
“જે વ્યક્તિ અલ્લાહ પર ભરોસો રાખે છે ત્યારે ખુદા તેના કાર્યો (પૂર્ણ થાય તે) માટે પૂરતો છે. નિઃસંશય અલ્લાહ પોતાની આજ્ઞાને પૂર્ણ કરનારો છે. એ શંકારહિત છે કે અલ્લાહે દરેક વસ્તુ માટે એક પ્રમાણ નક્કી કરી દીધું છે.”
(સૂરએ તલાક, આયત 3)

હદીસો:-

પયગમ્બરે અકરમ સ.અ.વ. ફરમાવે છે કે: “મનુષ્યને તેને જ સોંપી દેવામાં આવે છે કે જેની પાસેથી અપેક્ષા રાખતો હોય. જો મનુષ્ય ખુદા સિવાય બીજા કોઈ પાસે આશા ન રાખે તો અલ્લાહ પણ તેને બીજા કોઈને સોંપી નથી દેતો.”
(કન્ઝુલ ઉમ્માલ, હદીસ નં ૫૯૦૯)

આયતે કુરઆન:- “જે અલ્લાહ ઉપર ભરોસો રાખે છે, અલ્લાહ તેના માટે પૂરતો છે.” આ આયતના સંદર્ભમાં એક પ્રશ્નના જવાબમાં ઈમામ મૂસા કાઝિમ અ.સ.એ ફરમાવ્યું છે કે:

“(અલ્લાહ ઉપર) ભરોસો કરવાના પણ દરજ્જા હોય છે, તેમાંથી એક દરજ્જો એવો છે કે પોતાના સઘળાં કાર્યોમાં અલ્લાહ ઉપર ભરોસો રાખવો. એ તમારી સાથે જે કાંઈ કરે તેમાં જ રાજી રહો અને પ્રસન્ન રહો. તમારે એ જાણી લેવું જોઈએ કે તે તમારા માટે કોઈ પણ ભલાઈ અને કૃપા કરવામાં પાછીપાની કરતો નથી અને એ પણ જાણી લો કે અલ્લાહનો આ હુકમ આ સબંધે (આ અર્થમાં જ) છે તેથી પોતાના સઘળા કાર્યોને અલ્લાહના ભરોસે - અલ્લાહની જવાબદારીએ- છોડી દો અને તેના ઉપર જ ભરોસો રાખો.” (કાફી, ભાગ ૨, પાન નં ૬૫, હદીસ ૫)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا
وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُتَوَكِّلُونَ

ઈમામ સાદિક અ.સ.એ ફરમાવ્યું છે કે: “જો કોઈ વ્યક્તિ પોતાના કાર્યોને અલ્લાહને સોંપી દે છે તો સદાયે આરામ-સંતોષ અને (ખુદાની) દયા-કૃપાની છત્રછાયામાં પોતાનું જીવન વિતાવે છે અને પોતાના કાર્યોને ખુદાને સોંપી દેનાર એ વ્યક્તિ જ કહેવાય કે જેના સઘળા કાર્યો - સઘળી પ્રવૃત્તિઓ અલ્લાહને કાજે હોય.” (મિસ્બાહુશરીઅત, ભાગ ૧, પાન નં ૧૭૫, હદીસ ૮૩)



આપણાં નબી સ.અ.વ.ના સદ્ચારિત્રના દ્રષ્ટાંતો

(ક્રમશઃ ચાલનાર લેખમાળા)

પોતાના સઘળા કામો પોતે જ કરવા:

આપ હઝરત સ.અ.વ. પોતાના વસ્ત્રોને પોતે જ થીગડાં મારતાં હતાં. જુતાને પોતે જ સાંધતાં હતાં. ઘરમાં જે કામ સૌથી વધારે કરતા તે સિલાઈ કામ હતું. (મજમુઅએ વરમિ, પાન નં ૩૪)

બદલો માત્ર ખુદાના કાજે:

ઉપરોક્ત પુસ્તકમાં જ છે કે: “આપ હઝરત સ.અ.વ.એ પોતાના દાસો અને દાસીઓને ખુદાની આજ્ઞાંકિતતાના ગુના સિવાયના અન્ય કોઈ ગુનામાં કદી શિક્ષા કરી નહોતી. કદીયે પોતાના સ્વાર્થ માટે કોઈનાથી કદી બદલો લીધો નથી. જ્યાં ખુદાની આજ્ઞાંકિતતાના ગુના માટે જ્યાં શિક્ષા જરૂરી હતી ત્યાં જ કોઈને શિક્ષા કરતાં હતાં.” (મજમુઅએ વરમિ, પાન નં ૨૭૮)

તમામ નબીઓના એક સમાન સદ્ચારિત્ર:

કાફીમાં હઝરત ઈમામ સાદિક અ.સ.થી રિવાયત છે કે: “ખુદાએ જે કોઈ પણ નબીને બનાવ્યાં છે ત્યારે તેમને સત્યના માર્ગે ચાલવા અને થાપણની બાબતમાં પ્રમાણિક રહેવાની આજ્ઞા આપી છે. પછી તે થાપણ કોઈ સદ્ગૃહસ્થ (નેક) વ્યક્તિની હોય કે કોઈ દુષ્ટની હોય.” આ રિવાયત “તકસીરે અયાશી”માં પણ છે. (અલ-કાફી, પાન નં ૨૧૦૪)



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ حَدَّثَنَا سَوْدَةُ ابْنَةُ كَعْبَةَ الْغَدَارِيِّ بِأَنَّ

थापणने कदीये ओणवो नही:

“મજમુઅએ વરમિ”માં હઝરત ઈમામ જાઅફરે સાદિક અ.સ.થી રિવાયત છે કે: “કદીયે કોઈની થાપણ ઓળવશો નહીં કેમકે આપ હઝરત સ.અ.વ.ને સોય અને દોરો (અત્યંત તુચ્છ વસ્તુ) પણ થાપણ તરીકે આપવામાં આવતાં ત્યારે આપ તેને પણ તેના માલિકને પરત કરતાં હતાં.” (મજમુઅએ વરમિ, પાન નં ૧૦)

વચન પાલન:

મકારિમે અખ્લાકમાં હઝરત ઈમામ જાઅફરે સાદિક અ.સ.થી રિવાયત છે કે: “આપ હઝરત સ.અ.વ.એ એક વ્યક્તિને વચન આપ્યું કે હું ફલાણાં પત્થર (ખડક) પાસે તમને મળીશ, તમે આવી જશો.”

ઈમામ અ.સ.એ ફરમાવ્યું છે કે જ્યારે તે ખડક પાસે આપ સ.અ.વ.ને ખૂબ તડકો લાગ્યો ત્યારે આપના સાથીઓએ અરજ ગુજરી: “આપ અહિયાં છાંચડામાં આવી જાવ, તેમાં કાંઈ ખોટું નથી.”

આપ સ.અ.વ.એ ફરમાવ્યું: “મેં તેને આ ચોક્કસ સ્થળે મળવાનું વચન આપ્યું છે તેથી હું અહિયાં જ તેની પ્રતિક્ષા કરતો રહીશ. જો તે ન આવે તો વચન ભંગ તેણે કર્યો કહેવાશે.” (મકારિમે અખ્લાક, પાન નં ૨૪)

(સુન્નુન્નબી સ.અ.વ. નામના પુસ્તકમાંથી ચુંટી કાઢેલું)

અલ્લાહનો ન્યાય, કસોટીઓ અને મુસીબતો



આપણી ધાર્મિક માન્યતાઓ (અકાઈદ)માં અગત્યની બાબત “અલ્લાહનો ન્યાય” છે. ન્યાયનો અર્થ જ અત્યાચાર ન કરવું, દરેકને તેની શક્તિ પ્રમાણે આપવું, જ્યાં જે આવશ્યક હોય ત્યાં તેવું કાર્ય કરવું - આ સઘળું ન્યાય અને -ન્યાયિક શાસનનો ભાગ છે. આના વિરોધાભાસમાં અત્યાચાર અને અન્યાય છે. કુરઆને મજુદમાં અસંખ્ય સ્થળે ખુદાવન્દે આલમને “ન્યાયી” એટલે “બિન અત્યાચારી” વર્ણવવામાં આવેલ છે.

તેથી જ ઈશાદિ થએલ છે કે: “નિ:સંશય અલ્લાહ લોકો પર કોઈ (સહેજ પણ) અત્યાચાર નથી કરતો (પરંતુ) મનુષ્ય પોતે જ પોતાના જીવ ઉપર અત્યાચાર કરી લે છે.” (સૂરએ યુનુસ, આયત ૪૪)

મુશ્કેલીઓ અને વિડંબનાઓ કેમ??? અલ્લાહના ન્યાયનો સ્વીકાર કર્યા પછી અને તેમાં શ્રદ્ધા ધરાવ્યાં પછી લોકોના મનમાં સહેજ રીતે એવો પ્રશ્ન જરૂર ઉદ્ભવે છે કે તો પછી જગતમાંના આ અત્યાચારો અને વિડંબનાઓ અને દરરોજ વેઠવી પડે છે તે મુશ્કેલીઓ - આ બધું શું છે? આ ક્યાંથી આવે છે? આ બધું છે તે સંજોગોમાં અલ્લાહ ન્યાયી છે તે કેવી રીતે માની શકાય???

જવાબ: કુરઆને મજુદની આયતોને આધારે આપણે કહી શકીએ છીએ કે ખુદા તો ન્યાયી છે જ. પરંતુ આ જગતમાં જે યાતનાઓ છે તે બે પ્રકારની છે:

૧. કેટલીક યાતનાઓ અને કષ્ટ મનુષ્યો પોતાના જ કાર્યોને પરિણામે નોતરે છે. કુરઆને મજુદમાં પણ આ અંગેનો ઉલ્લેખ છે. એક સ્થળે ઈશાદિ થએલ છે કે: “અને જે પણ યાતના તમને થાય છે તે તમારા પોતાના હાથોની કમાણી છે.” (સૂરએ શૂરા, આયત ૩૦)

તેવી જ રીતે એક અન્ય સ્થળે ફરમાવ્યું છે કે: “લોકોની પોતાની કરણીને કારણે જ જમીન ઉપર અને સમુદ્રમાં અરાજકતા (યાતનાઓ) ફેલાઈ ગઈ છે કે જેથી તેમની કરણીના થોડાક (ભાગ)ની મજા તો અલ્લાહ તેમને ચખાડી દે કે કદાચને તેઓ (આવી કરણી કરતો) અટકે.” (સૂરએ રૂમ, આયત ૪૧)

૨. કેટલીક યાતનાઓ અને કષ્ટો એવા પ્રકારના હોય છે જેમનો સંબંધ ખુદાવન્દે આલમ સાથે છે. તે ત્રણ પ્રકારના હોય છે:

(૧) કેટલીક યાતનાઓ અત્યાચારીઓને બીવડાવવા માટે અને તેમને સાવચેત કરવા માટેની હોય છે. આ સંબંધે ઈશ્દિ થએલ છે કે: “અને જે લોકો આજ્ઞાનું પાલન નહોતાં કરતાં તેમના આજ્ઞાપાલન ન કરવાને કારણે અમે તેમને કસોટીએ ચઢાવ્યાં હતાં.” (સૂરએ આઅરાફ, આયત ૧૬૩)

(૨) કેટલીક યાતનાઓ અને મુસીબતો મોમિનોની કસોટી માટે નાજિલ થાય છે. તે સંબંધે ઈશ્દિ થએલ છે કે: “અને અમે આ કાર્ય એટલા માટે કર્યું કે જેથી કરીને મોમિનોને ભારે કસોટીમાંથી પસાર કરીએ. ખચીત જ અલ્લાહ બધું જ સાંભળનાર અને જાણનાર છે.” (સૂરએ અન્ફાલ, આયત ૧૭)

(૩) કેટલીક યાતનાઓ અને મુસીબતો એવા પ્રકારની હોય છે કે જેમને “અવલિયાએ ખુદા”ના દરજ્જા અને સ્થાનને ઉચ્ચ શિખરે પહોંચાડવા માટે નાજિલ કરવામાં આવે છે. આ કારણે જ જનાબ ઈબ્રાહીમ અ.સ. માટે ઈશ્દિ થએલ છે કે: “અને તે સમયને યાદ કરો જ્યારે અલ્લાહે ઈબ્રાહીમ અ.સ.ની થોડાક શબ્દોથી પરીક્ષા લીધી અને ઈબ્રાહીમ અ.સ. તેમાં પૂરા ઉતર્યા. (તેથી) તે પછી તેમને ઈમામતનો દરજ્જો આપવામાં આવ્યો.” (સૂરએ બકરહ, આયત ૧૨૪)

આ બાબતને ઈમામ અલી અ.સ.એ એક હદીસમાં પણ બયાન ફરમાવી છે કે: “યાતના અને મુસીબતો અત્યાચારીઓ માટે શિક્ષા, મોમિન માટે પરીક્ષા અને કસોટી અને નબીઓ માટે ઉચ્ચ દરજ્જાઓની પ્રાપ્તિનું કારણ હોય છે.” (બિહારૂલ અનવાર, ભાગ ૬૭, હદીસ ૨૩૫)



ધ્યેયના પ્રકાર

મનુષ્ય પોતાના કાર્યો અંગે જે ધ્યેય (નિયત) ધરાવે છે તે ત્રણ પ્રકારના હોય છે અને તેના કાર્યોના લાભ પણ તેને તે પ્રકારે જ મળે છે તેથી કુરઆનમાં વર્ણન છે કે મનુષ્યના ધ્યેય (નિયત) અનેક પ્રકારના હોય છે:

કેટલાંક લોકો એવા હોય છે કે તેઓ દુષ્ટ કાર્યો કરે છે પરંતુ એવા વિચારમાં રાચતાં રહે છે કે આ તો સદ્કાર્ય જ છે. તેમના માટે ઈશ્વરે થએલ છે કે: “શું અમો તમને જણાવી દઈએ કે (પોતાના) કાર્યો (આઅમાલ)ના ધોરણે સૌથી નિષ્ફળ લોકો કોણ છે? એવા લોકો એ છે કે જેમના પ્રયત્નો આ જગતના જીવનમાં (તેમને) કોઈ લાભ નથી પહોંચાડતાં જ્યારે તેઓ તો એવું જ સમજતાં હતાં કે તેઓ સારું-યોગ્ય કામ જ કરી રહ્યાં છે.” (સૂરએ કહફ, આયત ૧૦૩, ૧૦૪)

કેટલાંક લોકો એવા હોય છે કે જેઓ સદ્કાર્યો તો કરતાં હોય છે પરંતુ ઈમાનની નબળાઈને કારણે દેખાડા અને આડંબરમાં સપડાઈ જાય છે તેથી જ કુરઆન આવા લોકોને સાવચેત કરવા માટે કહે છે કે:

“હે ઈમાન લાવનારાઓ! પોતાના દાનને ઉપકાર જાહેર કરીને અને તે રીતે ઈજા પહોંચાડીને એવી વ્યક્તિની જેમ બરબાદ ન કરી દો કે જે વ્યક્તિ પોતાના ધનને ફક્ત લોકોમાં દેખાવ કરવામાં ખર્ચી નાંખે છે.” (સૂરએ બકરહ, આયત ૨૬૪)

કેટલાંક લોકો એવા હોય છે કે જેઓ સદ્કાર્યો નથી કરતાં પરંતુ એવું ઈચ્છે છે કે લોકો તેમણે ન કરેલાં કામોની ખોટી પ્રશંસા કરે તેમના માટે ઈર્શાદ થએલ છે કે: “આ લોકો એવા કાર્યોની પ્રશંસા સાંભળવા માંગે છે જે તેમણે કર્યા જ નથી. આપ એમને અઝાબથી સુરક્ષિત ન સમજતાં.” (આલે ઈમરાન, આયત ૧૮૮)

કેટલાંક સદ્ગૃહસ્થો એવા હોય છે જેઓ સદ્કાર્યો કરે છે પરંતુ એવું બિલ્કુલ પસંદ નથી કરતાં અને તેની આશા પણ નથી રાખતાં કે કોઈ તેમની પ્રશંસા કરે, આવા સદ્ગૃહસ્થની બાબતે પણ કુરઆનમાં ઉલ્લેખ છે કે: “આ લોકો કહે છે કે અમે (અમારા સદ્કાર્યોના બદલામાં) લોકો પાસેથી કોઈ બદલો અને તેમના આભારની પણ આશા નથી રાખતાં.” (સૂરએ ઈન્સાન, આયત ૯)



જન્મતના સઘળા દ્વાર ઉઘાડી શકો છો!

ઈમામ અલી અ.સ.એ ફરમાવ્યું છે કે જે વ્યક્તિમાં આ છ નેક ગુણ હોય તે પોતાના માટે જન્મતના તમામ દ્વારો ઉઘાડી નાંખે છે અને જહન્નમના તમામ દ્વાર પોતાના માટે બંધ કરી દે છે; એ વ્યક્તિ એવો હોય છે કે:-

قال رسول الله صلى الله عليه وآله وسلم

الإسلام

"ان الحسن و الحسين سيدا شباب اهل الجنة"

عبداللہ

૧. જે અલ્લાહને ઓળખે અને તેની આજ્ઞાઓનું પાલન કરે.
૨. જે શયતાનને ઓળખે અને તેનો વિરોધ કરે.
૩. જે સત્યને ઓળખે અને તેનું અનુસરણ કરે.
૪. જે અસત્યને ઓળખે અને તેનાથી દૂર ભાગે.
૫. જે જગતને ઓળખે અને તેની (પદ્મભ્રષ્ટ કરનાર-કુમાર્ગે દોરનાર) વસ્તુઓથી પોતાને સુરક્ષિત રાખીને રહે.
૬. જે આખેરતને ઓળખે અને તેને મેળવવા પ્રયત્ન કરે.



रसूलुल्लाह हजरत मुहम्मद स.अ.व.ना

विशिष्ट गुणो

(क्रमशः चालनार लेखमाणा - १लो हम्नो)

१. आप हजरत स.अ.व. चालती वजते अभिमानथी चालतां नहोतां परंतु हणवेथी आत्म सन्मान साथे चालतां हतां.

२. ज्यारे कोर्धनी साथे वात करतां तेनी दृशामां पूरेपूरा इरी जतां हतां.

३. आप पोतानी दृष्टि नीये राजतां हतां.

४. आप हमेशां वियारमग्न रहतां हतां.

५. आप दुःख अने शोकमां गरकाव रहतां हतां.

६. जरूरी न होय त्यां सुधी बोलतां नहोतां.

७. आपनी वाणी तदन सादी परंतु अर्थसत्तर रहती; ओछा शब्दोमां घणुं बधुं कही जतां हतां.

८. आपनामां सप्ताई अने हलकी भाषाना प्रयोगनी टेव नहोती.

وَأَنْتَ لَعَلَّ حَسْبُ عَظِيمٍ

૯. આપ કોઈને પણ તુચ્છ ગણતાં નહોતાં.
૧૦. આપ સત્યને સ્પષ્ટ કરનારા હતાં.
૧૧. આપ અન્યો સાથે પ્રસન્ન ચિત્તે - સદ્વ્યવહારથી અને નરમાશથી વ્યવહાર કરતાં હતાં.
૧૨. (અલ્લાહની) નજીવી દયા-કૃપાને પણ આપ મહાન દયા-કૃપા (નેઅમત) ગણતાં હતાં.
૧૩. આપે (અલ્લાહની) કોઈ પણ કૃપા (નેઅમત)ની ટીકા નથી કરી.
૧૪. ખાવા-પીવાની વસ્તુઓમાંથી જે પસંદ પડે તે લઈ લેતાં હતાં પરંતુ જે ના ગમે તેને ખરાબ કહ્યા વગર છોડી દેતાં હતાં.
૧૫. ઐહિક બાબતોના નુકશાનની બાબતે ક્યારેય દુઃખ અને શોક દર્શાવતાં નહોતાં.
૧૬. ખુદાના કાજે એટલાં કોપિત થઈ જતાં કે આપને કોઈ ઓળખી પણ ન શકે. (એટલે કે આપ સ.અ.વ.નો કોધ ફક્ત અલ્લાહના માટે જ થતો હતો, બીજા કોઈ કારણે નહીં.)



ઈર્ષાળુની નિશાનીઓ

ઈમામ જાઅફર સાદિક અ.સ.થી રિવાયત છે કે
જનાબ લુકમાને પોતાના પુત્રને ફરમાવ્યું હતું કે: હે
પુત્ર! ઈર્ષાળુની ત્રણ નિશાનીઓ છે:

૧. ઈર્ષાળુ પીઠ પાછળ ભૂંડુ બોલે છે.
૨. જ્યારે તમારી સમક્ષ હોય છે ત્યારે ખુશામદ
અને ચાપલૂસી કરે છે.
૩. મુસીબતના સમયે નિંદા અને બુરાઈ કરે છે.

(બિહારૂલ અનવાર, ભા ૯૬, પાન નં ૨૦૬)



પાપાણહૃદયી વ્યક્તિની નિશાનીઓ



ઈમામ અલી અ.સ. એ ફરમાવ્યું છે કે
પાપાણહૃદયી વ્યક્તિની બે નિશાનીઓ છે:

૧. તેની આંખોના અશ્રુઓ સુકાઈ જાય છે.
૨. તેના ગુનાહો વધી જાય છે.

(એલલુશરાએઅ, પ્રકરણ ૭૨, પા ૮૧)



પત્રાવલી

વહાલા બાળકો,
આ પેજ તમે મોકલેલા પત્રોમાંથી
સારામાં સારો પત્ર શોધીને
છાપવામાં આવશે...
તમારા જ અક્ષરમાં...
પત્ર બ્લેક પેનથી લખશો, સુંદર
અક્ષરમાં...

સહતંત્રી.





ગુનાહોનું આચરણ

કુરઆનની દ્રષ્ટિએ ગુનાહોનું આચરણ કરવાવાળા ત્રણ પ્રકારના લોકો હોય છે:

૧. કેટલાંક લોકો એ હોય છે જે ગુનાહ કર્યા પછી પ્રાયશ્ચિત કરે છે અને પોતા માટે માફી (મગફિરત) માંગે છે. ખુદાવન્દે આલમ એવા લોકોને માફ કરી દે છે.

૨. કેટલાંક લોકો એવા હોય છે જે ગુનાહ કર્યા પછી પસ્તાવો કરતાં નથી પરંતુ ગુનાહને પોતે મેળવેલ કાર્ય (લાભદાયક) ગણે છે. એવા લોકો પોતે જ પોતાને નુકશાન પહોંચાડે છે. અલ્લાહનો અઝાબ તેમની પ્રતિક્ષામાં હોય છે.

૩. કેટલાંક લોકો એવા પણ હોય છે જે ગુનાહ કર્યા પછી તે ગુનાહને બીજા સાથે જોડી દે છે. આવા લોકો બેવડો ગુનાહ કરે છે. તેમના માટે બમણો અઝાબ હશે; ગુનાહ કરવાનો અને બીજા ઉપર ખોટો આરોપ મુકવાનો.

وَاللَّهُ مَنَّ عَلَى الْكَاذِبِينَ وَكَانَ اللَّهُ كَثِيفًا

وَاللَّهُ مَنَّ عَلَى الْكَاذِبِينَ وَكَانَ اللَّهُ كَثِيفًا

કુરઆને મજીદમાં ઉપરોક્ત ત્રણે પ્રકારના લોકોનો ઉલ્લેખ થયો છે. ઈર્શાદ થએલ છે કે જે કોઈ ગુનાહોનું આચરણ કરે અથવા પોતે જ પોતાના ઉપર અત્યાચાર કરે પછી અલ્લાહથી ગુનાહોની માફી માંગી લે તો અલ્લાહ તેના માટે જતું કરનાર- માફ કરનાર અને દયા કરનાર છે અને જે ભૂંડા કાર્યો કરશે તે પોતાના માટે મુસીબત વહોરી લે છે અને અલ્લાહ તો સંપૂર્ણ જ્ઞાન અને ડહાપણ ધરાવનાર છે અને જે કોઈએ ખોટું કાર્ય અથવા ગુનાહ કર્યા અને પછી પોતાના કાર્યને કોઈ બેગુનાહ વ્યક્તિના માથે નાંખી દે તો નિ:શંકપણે તેણે એક મોટી આળ અને દેખીતા ગુનાહનો બોજો પોતાના માથે વહોરી લીધો. (સૂરએ નિસાઅ, આયત ૧૧૦ થી ૧૧૧)

ماہنامہ

₹/. 30

PUBLISH 10TH EVERY MONTH, RNI No: GUJGUJ/2015/59960

REGISTERED UNDER POSTEL REGISTRATION No: AHD-C/51/2015-2018 VALID UP TO 31TH DECEMBER 2018

ISSUED BY THE SSPO'S AHMEDABAD CITY DIVISION, PERMITTED TO POST AT AHMEDABAD PSO ON 10TH OF EVERY MONTH

PUBLISHED FROM: HAUZA-E-ILMIYAH IMAM KHOMAINI CHARITABLE TRUST

865/866, BEHIND TASLIM SOCIETY, NEAR GOLDEN PARK, VATVA, AHMEDABAD - 382 440



હઝરત માઅસૂમએ કુમ (સલા.) ઈરાન



PRINTED AND PUBLISHED BY: RIZVI MOHMED RAZA ABID HUSEIN ON BEHALF OF

HAUZA-E-ILMIYAH IMAM KHOMAINI CHARITABLE TRUST, RNI NO: GUJGUJ/2015/59960

AND PRINTED AT PRINT CARE, N.R. ESTATE, TAVDIPURA, SHAHIBAUG, AHMEDABAD-380 004

AND PUBLISHED FROM HAUZA-E-ILMIYAH IMAM KHOMAINI CHARITABLE TRUST

865/866, BEHIND TASLIM SOCIETY, NEAR GOLDEN PARK, VATVA, AHMEDABAD- 382 440

EDITOR: RIZVI MOHMED RAZA ABID HUSEIN

